

# કોર્ટ ઓફ કમિશનર (વિકલાંગ વ્યક્તિઓ માટેના)

ગુજરાત રાજ્ય

( Deemed Civil Court) વિકલાંગ ધારો (સમાન તકો, અધિકારોનું રક્ષણ અને પૂર્ણ ભાગીદારી) ૧૯૯૫  
ભોંયતળિયે બ્લોક નં. ૧૬, જુના સચિવાલય, સેક્ટર-૧૦, ગાંધીનગર- ૩૮૨૦૧૦

કેસ નં. ૫૪૪/૨૦૧૬

ક્રમાંક કમિ/અપગ/૨૦૧૬-૧૭ /

તા. /૦૮/૨૦૧૬

વાદી:-

શ્રી સૌત્રિક એમ.સમધ્યાર,  
ફ્લેટ નં. બી-૨૮ નાબોર્ડ વિહાર,  
સેન્ટ્રેલવિયર્સ કોલેજ કોર્નર પાસે,  
નવરંગપુરા, અમદાવાદ

વિરુદ્ધ

પ્રતિવાદી:-

રજિસ્ટ્રારશ્રી,  
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી,  
(જે.એન.એલ.યુ.) કોબા,  
ગાંધીનગર

વિષય:- જી.એન.એલ.યુ., રજીસ્ટ્રેશન નં. ૧૨ બી એલ.એલ.બી.નો પાંચ વર્ષનો  
અભ્યાસ ક્રમ પુરો કરવા બાબત.

શ્રી સૌત્રિક એમ.સમધ્યાર,  
ફ્લેટ નં. બી-૨૮ નાબોર્ડ વિહાર, સેન્ટ્રેલવિયર્સ કોલેજ કોર્નર પાસે,  
નવરંગપુરા, અમદાવાદ.

શ્રી સૌત્રિક એમ. સમધ્યાર ફ્લેટ નં. બી-૨૮ નાબોર્ડ વિહાર, સેન્ટ્રેલવિયર્સ કોલેજ કોર્નર  
પાસે, નવરંગપુરા, અમદાવાદે તા.૩/૬/૨૦૧૬ ની અરજીથી વિકલાંગ ધારો-૧૯૯૫ અન્વયે આ  
કોર્ટને ફરિયાદ કરેલ. કેસની મુદત તા.૭/૭/૨૦૧૬ ના રોજ રાખવામાં આવેલ.

૨. તા.૭/૭/૨૦૧૬ના રોજ મુદતમાં અરજદારશ્રી સૌત્રિક એમ.સમધ્યાર અને તેમના  
વાલી શ્રી સમધ્યાર હાજર રહેલ તેઓએ નીચે મુજબ રજૂઆત કરેલ.

(૧) શ્રી સૌત્રિક એમ. સમધ્યાર ૭૫ ટકા અશક્તતા ધરાવે છે, તેઓ જન્મથી સી.પી. છે.  
તેઓને ચાલવામાં અને બોલવામાં પણ લોકમોટસ વિકલાંગતાની તકલીફ રહેલ  
છે. Law ની પરીક્ષા-૨૦૧૨ની પરીક્ષામાં અપંગને ૩ ટકા અનામતની બેઠકમાં

તેઓ બી.એ. એલ.એલ.બી., કોર્ષ માટે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં પ્રવેશ મળેલ છે.

(૨) પ્રવેશ મળ્યા બાદ વિકલાંગ ધારો -૧૯૯૫ અને વખતો વખત યુનિવર્સિટી અને ગ્રાન્ટ કમિશનની સુચનાઓ હોવા છતાં તેઓને તે અન્વયે કોઈ સવલત આપવામાં આવેલ નથી.

૩. તેઓને જુદા જુદા સેમીસ્ટરની પરીક્ષામાં વધારાના સમય વૈકલ્પિક સમિક્ષા લઈયાવગેરેની સવલત નહીં આપતા તા.૦૩/૧૦/૨૦૧૨ થી વખતો-વખત યુનિવર્સિટીને રજૂઆત કરેલ છે. આમ છતાં તેમને કોઈ સવલત નહીં મળવાના કારણે જુદા જુદા સેમીસ્ટર પેપરોમાં પાસ થઈ શકેલ નથી.

૪. એલ.એલ.બી.નો કોર્ષ - ૨૦૧૨ થી જુલાઈ- ૨૦૧૭ સુધી ૫ વર્ષ માટે નિયત કરાયેલ છે તેમાં તેઓને વખતો -વખત લાભ આપવામાં આવેલ ના હોય તેઓ નિયત તકમાં સેમીસ્ટર પાસ કરી શક્યા નથી. આ ના કારણે મુશ્કેલીઓ અનુભવે છે. જે ધ્યાને લઈ તેમાં યુનિવર્સિટી પાસેથી નીચે મુજબના હુકમો કરવામાં આવે છે.

(૧) પરીક્ષામાં ખાસ પ્રકારની સવલતો પુરી પાડવી.

(૨) પરીક્ષામાં વળતરરૂપ સમય આપવો.

(૩) પ્રોજેક્ટ વર્ક વગેરે કાર્યમાં વૈકલ્પિક મુલ્યાંકન સવલત પુરી પાડવી.

(૪) ખાસ સલાહ અને માર્ગદર્શન આપવું.

૫. તેઓને તા.૧૬/૭/૨૦૧૬ રોજના પત્રથી આ કચેરીની મુદતે નીચે મુજબની વધારાની માંગણીઓ પરત્વે હુકમો કરવા વિનંતી છે.

(૧) તેઓ જુલાઈ-૨૦૧૨ થી મે- ૨૦૧૭ સુધી ૫ વર્ષના સમયગાળાના એલ.એલ.બી.નો કોર્ષ પુરો કરવા માટે તક આપવામાં આવેલ. જે માટે તેઓને ૬ઠા સેમીસ્ટર સાથે ૯માં સેમીસ્ટરના કલાસમાં જવા હાજરી આપવામાં આવે છે તથા ૮ માં સેમીસ્ટરમાં ૧૦ માં

સેમીસ્ટરમાં હાજરી આપવા અનુમતી આપવા પરીક્ષા પાસ કરવા માટે પરવાનગી આપવામાં આવે.

- (૨) ૯માં સેમીસ્ટરની ૧૦માં સેમીસ્ટર સુધી પરીક્ષામાં વધારાનો સમય વૈકલ્પિક મુલ્યાંકન ની સવલત આપવામાં આવે. સૌત્રિકના વાલીને તેઓનો વખતો વખત પત્રનો જવાબ આપવામાં આવેલ છે તેઓને નહીં સાંભળવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.

સમગ્ર બાબતોને ધ્યાને લેતાં હું નીચે મુજબ તારણ ઉપર આવું છું. શ્રી સૌત્રિક સમધ્યાર ૭૫ ટકા વિકલાંગતા ધરાવે છે અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી પ્રવેશ મેળવી અભ્યાસ કરતાં ઉમેદવાર તેઓ હાલમાં ૫ વર્ષના નિયત સમયગાળામાં તેમને એલ.એલ.બી.ની સંપૂર્ણ પરીક્ષા પાસ કરી શકે તેમ નથી, પરંતુ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ૫ વર્ષના સમયગાળા ઉપરાંત તેઓને એલ.એલ.બી.ની પરીક્ષા પસાર કરવા સમય આપવા તૈયાર છે તે સંજોગોમાં શ્રી સૌત્રિક એમ.સમધ્યારની રજૂઆત યુનિવર્સિટીના નિતિ-નિયમો મુજબ યોગ્ય જવાબદારી જે ધ્યાને લઈ હું નીચે મુજબનો હુકમ કરું છું.

### હુકમ

શ્રી સૌત્રિક એમ. સમધ્યાર, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી તેઓને તા.૩/૬/૨૦૧૬ની રજૂઆત અન્વયે નિયમોનુસાર ભલામણ કરી નીતિ-નિયમો અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન ભારતીય વિકલાંગ ધારો વખતો વખત રજૂઆત અન્વયે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે.

(સંજય નંદન)

કમિશનર

નકલ રવાના:-

- (૧) શ્રી સૌત્રિક એમ.સમધ્યાર, ફ્લેટ નં. બી-૨૮ નાબોર્ડ વિહાર, સેન્ટ્રેલવિયર્સ કોલેજ કોર્નર પાસે,  
નવરંગપુરા, અમદાવાદ
- (૨) રજિસ્ટ્રારશ્રી, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, (જે.એન.એલ.યુ.) કોબા, ગાંધીનગર

